

Prime Minister's participation in the Quad Leaders' Summit

September 24, 2021

ક્વોડ લીડર્સ સમિટમાં વડાપ્રધાનને ભાગ લીધો

સપ્ટેમ્બર 24, 2021

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 સપ્ટેમ્બર 2021ના રોજ વોશિંગ્ટન ડીસી, યુએસએ ખાતે પ્રથમ વ્યક્તિગત ક્વાડ લીડર્સ સમિટમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન, જાપાનના વડા પ્રધાન યોશીહિડે સુગા અને અમેરિકાના રાષ્ટ્રપતિ જોસેફ બાઈડેન સાથે ભાગ લીધો હતો. નેતાઓએ મંતવ્યોનું ખૂબ જ મહત્વપૂર્ણ આદાનપ્રદાન કર્યું હતું. જેમાં સામુહિક હિતો, મૂલ્યો અને અંતર્ગત સિદ્ધાંતો પર ભાર મૂકાયો હતો જેના પર ક્વાડ ફ્રેમવર્ક આધારિત છે.

2. નેતાઓએ અફઘાનિસ્તાન અને દક્ષિણ એશિયા અને ઈન્ડો-પેસિફિકમાં પ્રાદેશિક પરિસ્થિતિ અંગે પોતપોતાના દ્રષ્ટિકોણ રજૂ કર્યા હતા. અફઘાનિસ્તાનના મુદ્દે તેઓ આતંકવાદ વિરોધી, માનવતાવાદી સહાયતામાં તેમનો સહકાર વધારવા સંમત થયા અને તાલિબાનને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ 2593 નું પાલન કરવા હાકલ કરી.

3. નેતાઓએ આતંકવાદી પ્રોક્સીના ઉપયોગની નિંદા કરી અને આતંકવાદી જૂથોને કોઈપણ લોજિસ્ટિકલ, નાણાકીય અથવા લશ્કરી સહાય ન આપવામાં આવે તે બાબતના મહત્વ પર ભાર મૂક્યો જેનો ઉપયોગ આતંકવાદી હુમલાઓ શરૂ કરવા અથવા પ્લાન કરવા માટે થઈ શકે છે, જેમાં સરહદ પારના હુમલાનો પણ સમાવેશ થાય છે.

4. ક્વાડ લીડર્સએ તેમની માર્ચ 2021 સમિટ પછી થયેલી પ્રગતિ, ખાસ કરીને કોવિડ -19 રસી ભાગીદારીની સમીક્ષા કરી હતી. તેઓએ વડાપ્રધાનની જાહેરાતને આપકારી હતી જેમાં તેમણે કહ્યું હતું કે ભારત ઓક્ટોબર 2021થી ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં 80 લાખ ડોઝ સાથે ભારતની બનાવેલી કોવિડ -19 રસીઓની સપ્લાય શરૂ કરશે. આંતરરાષ્ટ્રીય મુસાફરીને સામાન્ય અને તેના ઉદ્દેશ સાથે વડાપ્રધાને મુસાફરીના ધોરણોને સામાન્ય બનાવવા અ રસીકરણ પ્રમાણપત્રોની પરસ્પર માન્યતા આપવાનો પ્રસ્તાવ મુક્યો હતો.

5. નેતાઓએ આબોહવા પરિવર્તન, શિપિંગ અને પોર્ટ ઓપરેશન્સમાં ડિકાર્બોનાઈઝેશન પ્રયાસો, સ્વચ્છ હાઈડ્રોજન ટેકનોલોજીનો ઉપયોગ, જવાબદાર અને સ્થિતિસ્થાપક સ્વચ્છ ઊર્જા પુરવઠા સાંકળોની જરૂરિયાત અંગે હકારાત્મક ચર્ચા કરી હતી. આ સંદર્ભમાં, વડાપ્રધાને આપણી સંબંધિત શક્તિઓ અને ક્ષમતાઓને જોતા વૈશ્વિક ગ્રીન હાઈડ્રોજન ગઠબંધનનો પ્રસ્તાવ મૂક્યો. નેતાઓએ શિપિંગ ટાર્કફોર્સ પણ લોન્ચ કર્યું જે શિપિંગ વેલ્યુ ચેઈનને હરિયાળી અને ડિકાર્બોનાઈઝિંગનું સંકલન કરશે. મુંબઈ પોર્ટ ટ્રસ્ટ અન્ય ત્રણ ક્વાડ દેશોના અંદરો સાથે આ પહેલમાં ભાગ લેશે.

6. નેતાઓએ ટેકનોલોજી ડિઝાઈન, ડેવલપમેન્ટ, ગવર્નન્સ અને યુઝ પર ક્વાડ સિદ્ધાંતો જારી કર્યા છે જે માત્ર પ્રદેશને જ નહીં પરંતુ વિશ્વને જવાબદાર, ખુલ્લા, ઉચ્ચ-ધોરણની નવીનતા તરફ લઈ જવામાં મદદ કરશે.

7. લોકોને લોકો સાથે જોડવા માટે સુવિધાઓને મજબૂત કરવા માટે, નેતાઓએ યુએસએમાં સ્ટેમ ક્ષેત્રોમાં માસ્ટર્સ અને ડોક્ટરલ ડિગ્રી મેળવવા માટે દર વર્ષે 100 વિદ્યાર્થીઓ માટે ફેલોશિપ પ્રોગ્રામની જાહેરાત કરી.

8. એક ક્વાડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોઓર્ડિનેશન ગ્રુપની જાહેરાત કરવામાં આવી હતી જે પ્રાદેશિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતોનું મૂલ્યાંકન કરશે અને અભિગમ, તકનીકી સહાય અને ક્ષમતા નિર્માણના પ્રયત્નોને સંકલિત કરશે.

9. નેતાઓએ મોનિટરિંગ અને હવામાનમાં ફેરફારના પરિવર્તન, આપત્તિનો સામનો કરવા માટેની સજ્જતા, અને વહેંચાયેલા ડોમેઈનસમાં પડકારોનો સામનો કરવા માટે સેટેલાઈટના ડેટાની આપલે કરવા માટે સ્પેસ કોઓપરેશન વર્કિંગ ગ્રુપની પણ સ્થાપના કરી છે.

10. આ સમિટ એ નેતાઓ માટે ક્વોડની સકારાત્મક ગતિ રચવા અને તેના રચનાત્મક એજન્ડાને વૈશ્વિક ભલાઈ માટે વાપરવાની તક હતી. નેતાઓએ મુક્ત, ખુલ્લા અને સમાવિષ્ટ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે તેમની પ્રતિબદ્ધતા અને સહિયારી દ્રષ્ટિનો પુનરોચ્ચાર કર્યો હતો. તેઓ નિયમિત સંપર્ક જાળવવા અને ઉચ્ચ સ્તરીય સંવાદ ચાલુ રાખવા માટે સંમત થયા હતા.

બેઠકના પરિણામના દસ્તાવેજો

a. સંયુક્ત નિવેદન

b. ફેક્ટ શીટ

c. સ્ટેટ ઓફ પ્રિન્સિપલ્સ ઓન ટેકનોલોજી ડિઝાઈન, ડેવલપમેન્ટ એન્ડ ગવર્નન્સ

વોશિંગ્ટન ડી.સી.

સપ્ટેમ્બર 24, 2021

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.